

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૩/૦૧/૨૦૧૮ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૨ કેસ કરી, ૧૯ વ્યક્તિઓને ઝડપી, ૭૮ લીટર દેશી દારૂ, ૧૨૯ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૦૪ બીયરટીન કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૦૩ કેસ કરી, ૧૧ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૨૦,૫૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

રોકડ ભરેલ પર્સ ખેંચી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૭/૧૮

વાડજ: ગોવિંદભાઈ તુલસીભાઈ ખનેજા (ઉ.વ.૬૧) (રહે.રાજરતન રેસીડન્સી ઇન્દીરાબ્રીજ સર્કલ હાંસોલ) તા.૨/૧/૧૮ બપોરના ૨/૪૫ વાગ્યાના સુમારે ઉસ્માનપુરા વિદ્યાપીઠની બાજુમાં ખાદી ભંડારની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ગોવિંદભાઈ ખનેજાના હાથમાંથી પર્સ ઝુંટવી લઈ નાસી ગયા હતા આ પર્સમાં રોકડ રૂપિયા ૮૦,૦૦૦/- તથા જરૂરી કાગળો હતા. આ અંગેની ફરીયાદ ગોવિંદભાઈ ખનેજાએ વાડજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.ડી.પુ રોહીત ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૮/૧૮

સેટેલાઇટ : પ્રિયંકાબેન વા/ઓ ધવલભાઈ પટેલ (ઉ.વ.૩૩)(રહે,શ્રેયસ બંડ્લોઝ, માલતી ફ્લેટની ગલીમા સ્વીટ હોમ સોસાયટી પાસે સેટેલાઇટ) એ તા.૦૨/૦૧/૧૮ નારોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૫/૨૦૧૭ થી તા.૨૨/૧૦/૨૦૧૭ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘરમાં કામ કરતી અનાપા પ્રદીપભાઈ કામત (રહે,નીયોજનનગર માણેકબાગ હોલ સામે આંબાવાડી) એ ઘરમાંથી સોના-ચાંદી ના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧૦,૬૯,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એસ.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૯/૧૮

ઘાટલોડીયા: વસંતકુમાર ચંપકલાલ ખત્રી (ઉ.વ.૫૭)(રહે, સુદર્શન એપાલુ મિનગર પાસે સાંઠબાબા મંદિરની પાછળ ઘાટલોડીયા) એ કોઈ અગમ્ય કારણ સર તા.૦૨/૦૧/૧૮ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખા ના હુકમા દોરી બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માતમોત નોંધી આ અંગેની તપાસ મસઇ.શ્રી કમલેશભાઈ કાળાભાઈ ચલાવે છે

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.